

# Visit of Shri V. Muraleedharan, Minister of State for External Affairs to the Republic of The Gambia (1-3 November 2021)

November 05, 2021

## રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી વી. મુરલીધરનની રિપબ્લિક ઓફ ગામ્બિયા મુલાકાત (1-3 નવેમ્બર 2021)

નવેમ્બર 05, 2021

રાજ્યકક્ષાના વિદેશ બાબતો અને સંસદીય બાબતોના મંત્રી શ્રી વી. મુરલીધરને 1-3 નવેમ્બર 2021 દરમિયાન રિપબ્લિક ઓફ ગામ્બિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની 30 જુલાઈ-1 ઓગસ્ટ 2019ની ગામ્બિયા મુલાકાતના અનુસંધાને કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના મંત્રીએ ગામ્બિયાના રાષ્ટ્રપતિ એડામા બેરોસની મુલાકાત લીધી હતી. રાજ્યકક્ષાના મંત્રીએ વિદેશ બાબતો, આંતરરાષ્ટ્રીય સહકાર અને વિદેશમાં વસતા ગામ્બિયનોના મંત્રી ડો મમાડો ટંગારા સાથે દ્વિવપક્ષીય સહકાર અંગે વાત કરી હતી અને આપણા દ્વિવપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી ગામ્બિયાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મેરિયમ જેક ડેન્ટોમ, ઉચ્ચ શિક્ષણ, રિસર્ચ, સાયન્સ અને ટેકનોલોજી મંત્રી બડારા જૂકને મળ્યા હતા. ભારત અને ગામ્બિયા વચ્ચે દ્વિવપક્ષીય સહકાર અને વિકાસ ભાગીદારી વધારવા માટે પરસ્પર ઈચ્છા જોવા મળી છે.

2. આ મુલાકાત દરમિયાન બે કરાર પર સહી થઈ હતી જેમાં રાજદૂવારી અને અધિકૃત પાસપોર્ટધારકો માટે વિઝાની આવશ્યકતામાંથી મુક્તિ પરનો કરાર અને ભારત અને ગામ્બિયા વચ્ચે સહકાર માટેના સામાન્ય ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગામ્બિયાની વિનંતીના આધારે આ મુલાકાત દરમિયાન ડાયાલિસિસ મશીન ખરીદવા માટે 5,00,000 અમેરિકન ડોલરની ગ્રાન્ટનો હેતુકેર કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન વિદેશ બાબતો, આંતરરાષ્ટ્રીય સહકાર અને વિદેશમાં વસતા ગામ્બિયનવાસીઓના મંત્રી ડો. મામાડો ટંગારા અને રાજ્યકક્ષાના મંત્રીએ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત રીતે સ્મૃતિ સ્ટેમ્પ બહાર પાડી હતી.

3. રાજ્યકક્ષાના મંત્રીએ અંજુલમાં ગામ્બિયાના નેશનલ એસેમ્બલી બિલ્ડિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી, જે લાઈન ઓફ ક્રેડિટ હેઠળ બાંધવામાં આવેલ પશ્ચિમ આફ્રિકામાં સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ પૈકી એક છે. તેમણે ગ્રેટર અંજુલ વિસ્તારમાં યુપીવીસી વડે એસ્બેસ્ટોસ પાણીની પાઈપો બદલવાના બે ચાલુ ભારતીય એલઓસી પ્રોજેક્ટ, એક વિદ્યુતીકરણ વિસ્તરણ પ્રોજેક્ટ અને પાણીના પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે કાચીકલી મ્યુઝિયમ અને યુનિવર્સિટી ઓફ ધ ગામ્બિયા કન્સ્ટ્રક્શન સાઈટની પણ મુલાકાત લીધી, જે એક ભારતીય કંપની દ્વારા બાંધવામાં આવી રહેલો ગામ્બિયા સરકારનો પ્રોજેક્ટ છે.

4. ગામ્બિયામાં ભારતીયોનો એક બહુ નાનો પરંતુ જીવંત સમુદાય છે જેમાં લગભગ 1600 લોકો છે. તેઓ મોટા ભાગે વેપારીઓ અને બિઝનેસમેન છે. રાજ્યકક્ષાના મંત્રીએ આ મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. એકંદરે આ મુલાકાતે ગામ્બિયા સાથે આપણા સંબંધોને વધારે વૈવિધ્યકૃત કરવાનો અને તેને મજબૂત બનાવવાનું વાતાવરણ પેદા કર્યું હતું.

નવી દિલ્હી  
નવેમ્બર 5, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.